



બીઝ-એમ-પાવર ગ્રાન્ટ પ્રોગ્રામ

અમે આ ગ્રાન્ટ કાર્યક્રમ શા માટે શરૂ કરી રહ્યા છીએ?

MGCC મેસેચ્યુસેટ્સ માં ઓછી સેવા પ્રાપ્ત કરતાં સાહસિકો અને નાના ઉદ્યોગ માલિકોને આર્થિક સફળતા હાંસલ કરવામાં મદદ કરવા માટે સમર્પિત છે. આ પ્રોગ્રામ ઓછી-આવક અને મધ્યમ-આવક ધરાવતા ઉદ્યોગસાહસિકોને તેમના સુવિધાના સંપાદન, વિસ્તરણ, સુધારણા અથવા લીઝ (ભાડાપટ્ટા), સાધનોની ખરીદી અથવા લીઝ અથવા ક્રેડિટ ફંડિંગ દ્વારા વ્યવસાયની અન્ય મૂડી જરૂરિયાતોને પહોંચી વળવામાં સહાય કરવા પર કેન્દ્રિત છે.

બીઝ-એમ-પાવરનો ઉદ્દેશ ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયને વધારવા અને સ્થાનિક રહેવાસીઓ, પાડોશીઓ, સમુદાયના સભ્યો અને હિસ્સેદારોના મેળવેલ સમર્થન દ્વારા મૂડી પ્રાપ્ત કરવા માટે નવીન અભિગમો તરફ આગળ વધવા માટે નવું જ્ઞાન અને કુશળતા પ્રદાન કરવાનો છે.

બીઝ-એમ-પાવરમાં મેસેચ્યુસેટ્સના નાના બિઝનેસ માલિકોની આર્થિક સફળતા માટે અને ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટે બે તબક્કાઓ છે. ધ્યેય બીઝ-એમ-પાવર ગ્રાન્ટ માટે અરજી કરતા વ્યવસાયો માટે મૂડી/ઇક્વિટી વધારવા માટે સમર્થન દ્વારા મેસેચ્યુસેટ્સના નાના બિઝનેસ માલિકોની આર્થિક સફળતાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રથમ તબક્કો હશે પ્રોગ્રામ માટે અરજી કરવી, જેમાં MGCCના સ્મોલ બિઝનેસ ટેકનિકલ આસિસ્ટન્સ (SBTA) એટલે કે નાના વ્યાપાર માટે તકનીકી સહાય પ્રદાતાઓના નેટવર્કમાંથી સંસ્થા સાથે ભાગીદારીની જરૂર પડશે, જે અરજદારો માટે પ્રાયોજક તરીકે સેવા આપશે. બીજા તબક્કામાં, બાકી એમજીસીસી અરજીની મંજૂરી અને પેટ્રોનિસિટીની મંજૂરી, સમુદાય સમર્થનનો લાભ લેવા અને તેમની ગ્રાન્ટ અરજીમાં વિનંતી કરેલ રકમ મેળવવા ભંડોળ એકત્ર કરવા માટે પેટ્રોનિસિટીના ક્રેડિટ ફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે હશે.

નાણાકીય વર્ષ 2021 (FY21) માટે કોમનવેલ્થના ઓપરેટિંગ બજેટ દ્વારા ફાળવવામાં આવેલા ભંડોળના કુલ \$7,500,000 દ્વારા, સફળ ક્રાઉડફંડિંગ અભિયાન માટે આ તકને સક્ષમ કરવા માટે \$20,000 સુધીની મેચિંગ ગ્રાન્ટ (અનુદાન) ઉપલબ્ધ છે. મહિલાઓ, લઘુમતીઓ, ઇમિગ્રન્ટ્સ, બિન-મૂળ વતની અંગ્રેજી ભાષીઓ, યુ.એસ. સૈન્યના નિવૃત્ત સૈનિકો, અપંગ વ્યક્તિઓ, LGBTQ+ (એલજીબીટીક્યુ+) સમુદાયના સભ્યો દ્વારા ચાલતા જીવંત ઉદ્યોગો જેવા નાના વ્યવસાયો અને મેસેચ્યુસેટ્સ ગેટવે સિટીઝમાં કાર્યરત વ્યવસાયોને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ ગ્રાન્ટ પ્રોગ્રામ શું છે?

આ ગ્રાન્ટ પ્રોગ્રામ એવા પ્રોજેક્ટ્સને આગળ ધપાવવા માટે ભંડોળમાં \$20,000 ની ગ્રાન્ટ મેચ (\$250 ફી બાદ જે એસબીટીએ પ્રાયોજકને ચૂકવવામાં આવશે) પૂરા પાડશે જે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા સામાજિક અને આર્થિક રીતે વંચિત વ્યક્તિઓના નાના ઉદ્યોગોને ભંડોળ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. એસબીટીએ પ્રદાતાઓ એપ્લિકેશન પ્રક્રિયાને એક્સેસ કરવા અને પૂર્ણ કરવા માટે નાના વ્યવસાયોને પ્રાયોજિત કરશે અને સહાય કરશે. નાના બિઝનેસ અરજદાર, તેમના એસબીટીએ પ્રાયોજકની મદદ વડે, અને જો આગામી પગલાંઓ માટે મંજૂર થાય તો એક પેટ્રોનિસિટી કોચ સાથે તેમના ક્રાઉડફંડિંગ પ્રોજેક્ટમાં મદદ કરવા માટે.

અરજી કરવા માટે કોણ પાત્ર છે?

એક ઉદ્યોગસાહસિક અથવા નાનો વ્યવસાય હોવો આવશ્યક છે જે:

- મેસેચ્યુસેટ્સમાં કાર્યરત બ્રિક-એન્ડ-મોર્ટાર (ભૌતિક) સ્થાપના સાથે મેસેચ્યુસેટ્સમાં સ્થિત હોય
- 1-20 FTE કર્મચારીઓને રોજગારી આપી રહી હોય, જેમાં 1 અથવા વધુ વ્યવસાય માલિકનો સમાવેશ થતો હોય
- તે વ્યવસાયિક માલિકોની આવકનો પ્રાથમિક સ્ત્રોત હોય
- વાર્ષિક આવક \$2,500,000 કરતાં વધુ ન હોય
- MGCCના સ્મોલ બિઝનેસ ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (નાના વ્યાપાર તકનીકી સહાય કાર્યક્રમ) મારફત તકનીકી સહાય પ્રદાતા દ્વારા નામાંકિત કરવામાં આવેલ હોય

- ઓછામાં ઓછા 3 મહિના માટે વ્યવસાયિક કામગીરીના પ્રારંભિક તબક્કામાં કાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવેલ હોય
- બિન-નફાકારક, નફા-માટે-નહીં અથવા સખાવતી સંસ્થા નથી
- 2 થી વધુ સ્થાનો ધરાવતી ફેન્ચાઇઝ નથી, જેમાં વ્યક્તિગત રીતે માલિકીના અને સંચાલિત ફેન્ચાઇઝનો સમાવેશ થાય છે (2 જેસુધીના સ્થળો સાથેની ફેન્ચાઇઝીઝને ધ્યાનમાં લેવામાં આવશે)
- રિયલ એસ્ટેટ ભાડા/વેચાણ વ્યવસાય ન હોય
- લોબિસ્ટ ન હોય
- ગાંજા સંબંધિત વ્યવસાય ન હોય

માલિકી કોની હોવી જોઈએ:

- અરજી કરતી વખતે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ
- યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક અથવા કાયમી નિવાસી

આ ગ્રાન્ટ કાર્યક્રમ ક્યારે ખુલશે?

આ ગ્રાન્ટ કાર્યક્રમ જૂન 15, 2021 થી ખુલશે. આ રોલિંગ એપ્લિકેશન હશે જેમાં ગ્રાન્ટ એપ્લિકેશન સબમિશનની માસિક ધોરણે સમીક્ષા કરવામાં આવશે. 1^{લી} અંતિમ તારીખ 2 ઓગસ્ટ, 2021 છે.

હું કેવી રીતે અરજી કરી શકું?

તમામ અરજદારો MGCCના SBTA કાર્યક્રમ મારફતે ટેકનિકલ સહાય પ્રદાતા દ્વારા પ્રાયોજિત હોવા આવશ્યક છે. અમારા SBTA પ્રદાતાઓની સૂચિ માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો:

<https://www.empoweringsmallbusiness.org/fy2021-awardees>

કૃપા કરીને સંપૂર્ણ RFP, વધુ એપ્લિકેશન માહિતી, શરતો, ભંડોળના મંજૂર ઉપયોગ અને વધુ વિગતો અમારી વેબસાઇટ પર મેળવો: <https://www.empoweringsmallbusiness.org/bizmpower>